


પ્રજ્ઞા

ધોરણ
૨
ગણિત

વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર



શાળાનું નામ :

ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ

સર્વ શિક્ષા અભિયાન,
સેક્ટર-૧૭, ગાંધીનગર.
ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૭૮૬૫



સર્વ શિક્ષા અભિયાન
સૌ ભણે, સૌ આગળ વધે

એકમ

(૧૫) શું છે લાંબું, શું છે ગોળ ?

(૧૬) જૂથમાં ગણતરી

ક્રમ	વિદ્યાર્થીનું નામ
૧	
૨	
૩	
૪	
૫	
૬	
૭	
૮	
૯	
૧૦	
૧૧	
૧૨	
૧૩	
૧૪	
૧૫	
૧૬	
૧૭	
૧૮	
૧૯	
૨૦	
૨૧	
૨૨	
૨૩	
૨૪	
૨૫	

중미	1	2	3	4
1				
2				
3				
4				
5				
6				
7				
8				
9				
10				
11				
12				
13				
14				
15				
16				
17				
18				
19				
20				
21				
22				
23				
24				

[illegible]

၁	
၂	
၃	
၄	
၅	
၆	
၇	
၈	
၉	
၁၀	
၁၁	
၁၂	
၁၃	
၁၄	
၁၅	
၁၆	
၁၇	
၁၈	
၁၉	
၂၀	
၂၁	
၂၂	
၂၃	
၂၄	

1				
2				
3				
4				
5				
6				
7				
8				
9				
10				
11				
12				
13				
14				
15				
16				
17				
18				
19				
20				
21				
22				
23				
24				

1

2

3

4

[illegible]

એકમ

(૧૫) શું છે લાંબું, શું છે ગોળ ?

(૧૬) જૂથમાં ગણતરી

(૧૭) તમે કેટલું વજન ઊંચકી શકો છો ?

ક્રમ	૧	૨	૩	૪	૫	૬	૭	૮
૧								
૨								
૩								
૪								
૫								
૬								
૭								
૮								
૯								
૧૦								
૧૧								
૧૨								
૧૩								
૧૪								
૧૫								
૧૬								
૧૭								
૧૮								
૧૯								
૨૦								
૨૧								
૨૨								
૨૩								
૨૪								
૨૫								

૧								
૨								
૩								
૪								
૫								
૬								
૭								
૮								
૯								
૧૦								
૧૧								
૧૨								
૧૩								
૧૪								
૧૫								
૧૬								
૧૭								
૧૮								
૧૯								
૨૦								
૨૧								
૨૨								
૨૩								
૨૪								
૨૫								
	૧	૨	૩	૪	૫	૬	૭	૮

(૧૭) તમે કેટલું વજન ઊંચકી શકો છો ?

(૧૮) દશકની ગણતરી

ક્રમ	૧	૨	૩	૪	૫	૬
૧						
૨						
૩						
૪						
૫						
૬						
૭						
૮						
૯						
૧૦						
૧૧						
૧૨						
૧૩						
૧૪						
૧૫						
૧૬						
૧૭						
૧૮						
૧૯						
૨૦						
૨૧						
૨૨						
૨૩						
૨૪						
૨૫						

૧						
૨						
૩						
૪						
૫						
૬						
૭						
૮						
૯						
૧૦						
૧૧						
૧૨						
૧૩						
૧૪						
૧૫						
૧૬						
૧૭						
૧૮						
૧૯						
૨૦						
૨૧						
૨૨						
૨૩						
૨૪						
૨૫						
	૧	૨	૩	૪	૫	૬

(૧૮) દશકની ગણતરી

(੧੮) ਪੇਟਰਨ (ਜਰਾਫ਼)

[illegible]

1									
2									
3									
4									
5									
6									
7									
8									
9									
10									
11									
12									
13									
14									
15									
16									
17									
18									
19									
20									
21									
22									
23									
24									
	1	2	3	4	5	6	7	8	9

(੧੮) ਪੇਟਰ (ਜਰਾਫ਼)

(૨૦) પગનાં નિશાન

ક્રમ	૧	૨	૩	૪	૫	૬	૭
૧							
૨							
૩							
૪							
૫							
૬							
૭							
૮							
૯							
૧૦							
૧૧							
૧૨							
૧૩							
૧૪							
૧૫							
૧૬							
૧૭							
૧૮							
૧૯							
૨૦							
૨૧							
૨૨							
૨૩							
૨૪							
૨૫							

૧							
૨							
૩							
૪							
૫							
૬							
૭							
૮							
૯							
૧૦							
૧૧							
૧૨							
૧૩							
૧૪							
૧૫							
૧૬							
૧૭							
૧૮							
૧૯							
૨૦							
૨૧							
૨૨							
૨૩							
૨૪							
૨૫							
	૧	૨	૩	૪	૫	૬	૭

(૨૦) પગનાં નિશાન

(૨૨) દશક અને એકમ

ક્રમ	૧	૨	૩	૪	૫	૬
૧						
૨						
૩						
૪						
૫						
૬						
૭						
૮						
૯						
૧૦						
૧૧						
૧૨						
૧૩						
૧૪						
૧૫						
૧૬						
૧૭						
૧૮						
૧૯						
૨૦						
૨૧						
૨૨						
૨૩						
૨૪						
૨૫						

1							
2							
3							
4							
5							
6							
7							
8							
9							
10							
11							
12							
13							
14							
15							
16							
17							
18							
19							
20							
21							
22							
23							
24							
25							

(૨૨) દશક અને એકમ

(૨૩) મારો મજાનો દિવસ

[illegible]

1										
2										
3										
4										
5										
6										
7										
8										
9										
10										
11										
12										
13										
14										
15										
16										
17										
18										
19										
20										
21										
22										
23										
24										
	1	2	3	4	5	6	7	8	9	10

(૨૪) કહો, કેટલા થયા ?

ક્રમ	૧	૨	૩	૪	૫	૬	૭
૧							
૨							
૩							
૪							
૫							
૬							
૭							
૮							
૯							
૧૦							
૧૧							
૧૨							
૧૩							
૧૪							
૧૫							
૧૬							
૧૭							
૧૮							
૧૯							
૨૦							
૨૧							
૨૨							
૨૩							
૨૪							
૨૫							

૧							
૨							
૩							
૪							
૫							
૬							
૭							
૮							
૯							
૧૦							
૧૧							
૧૨							
૧૩							
૧૪							
૧૫							
૧૬							
૧૭							
૧૮							
૧૯							
૨૦							
૨૧							
૨૨							
૨૩							
૨૪							
૨૫							
	૧	૨	૩	૪	૫	૬	૭

(૨૪) કહો, કેટલા થયા ?

(૨૫) રેખાઓ જ રેખાઓ

ક્રમ	૧	૨	૩	૪	૫	૬	૭	૮
૧								
૨								
૩								
૪								
૫								
૬								
૭								
૮								
૯								
૧૦								
૧૧								
૧૨								
૧૩								
૧૪								
૧૫								
૧૬								
૧૭								
૧૮								
૧૯								
૨૦								
૨૧								
૨૨								
૨૩								
૨૪								
૨૫								

૧								
૨								
૩								
૪								
૫								
૬								
૭								
૮								
૯								
૧૦								
૧૧								
૧૨								
૧૩								
૧૪								
૧૫								
૧૬								
૧૭								
૧૮								
૧૯								
૨૦								
૨૧								
૨૨								
૨૩								
૨૪								
૨૫								
	૧	૨	૩	૪	૫	૬	૭	૮

(૨૫) રેખાઓ જ રેખાઓ

(૨૬) આપણું અને લેણું

ક્રમ	૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯	૧૦	૧૧	૧૨
૧												
૨												
૩												
૪												
૫												
૬												
૭												
૮												
૯												
૧૦												
૧૧												
૧૨												
૧૩												
૧૪												
૧૫												
૧૬												
૧૭												
૧૮												
૧૯												
૨૦												
૨૧												
૨૨												
૨૩												
૨૪												
૨૫												

૧												
૨												
૩												
૪												
૫												
૬												
૭												
૮												
૯												
૧૦												
૧૧												
૧૨												
૧૩												
૧૪												
૧૫												
૧૬												
૧૭												
૧૮												
૧૯												
૨૦												
૨૧												
૨૨												
૨૩												
૨૪												
૨૫												
	૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯	૧૦	૧૧	૧૨

(૨૬) આપણું અને લેણું









(૨૭) સૌથી લાંબું ડગલું

ક્રમ	૧	૨	૩	૪	૫	૬	૭	૮
૧								
૨								
૩								
૪								
૫								
૬								
૭								
૮								
૯								
૧૦								
૧૧								
૧૨								
૧૩								
૧૪								
૧૫								
૧૬								
૧૭								
૧૮								
૧૯								
૨૦								
૨૧								
૨૨								
૨૩								
૨૪								
૨૫								

1								
2								
3								
4								
5								
6								
7								
8								
9								
10								
11								
12								
13								
14								
15								
16								
17								
18								
19								
20								
21								
22								
23								
24								
25								

(૨૮) આવતાં જતાં પક્ષીઓ

ક્રમ	૧	૨	૩	૪	૫	૬	૭	૮
૧								
૨								
૩								
૪								
૫								
૬								
૭								
૮								
૯								
૧૦								
૧૧								
૧૨								
૧૩								
૧૪								
૧૫								
૧૬								
૧૭								
૧૮								
૧૯								
૨૦								
૨૧								
૨૨								
૨૩								
૨૪								
૨૫								

1								
2								
3								
4								
5								
6								
7								
8								
9								
10								
11								
12								
13								
14								
15								
16								
17								
18								
19								
20								
21								
22								
23								
24								
								

(૨૮) આવતાં જતાં પક્ષીઓ

[illegible][illegible]

અધ્યયન નિષ્પત્તિઓ

ધોરણ : ૨


વિદ્યાર્થીઓ...

- (૧) ● બે અંકની સંખ્યા સાથે કામ કરે છે. ૯૯ સુધીની સંખ્યા વાંચે છે અને લખે છે.
 - બે અંકની સંખ્યા લખવા અને તુલના કરવા સ્થાનકિંમતનો ઉપયોગ કરે છે.
 - બે અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવી શકે છે. (આપેલ અંકના પુનરાવર્તન સાથે અને તેના વગર).
 - બે અંકના સરવાળા કરીને રોજિંદા જીવનના કોયડા / સમસ્યા ઉકેલે છે.
 - બે અંકની બાદબાકી વડે રોજિંદા જીવનના કોયડા / સમસ્યા ઉકેલે છે.
 - ત્રણથી ચાર ચલણી નોટ અને સિક્કાની મદદથી ૧૦૦ રૂપિયા સુધીની કિંમત બતાવે છે. (એક અથવા અલગ-અલગ મૂલ્યવાળી)
- (૨) ● લાક્ષણિકતાઓનું અવલોકન કરીને દ્વિપરિમાણીય કે ત્રિપરિમાણીય આકારોનું વર્ણન કરે છે.
 - સમઘન, લંબઘન, નળાકાર, શંકુ અને ગોળા જેવા ત્રિપરિમાણીય આકારોને ઓળખે છે.
 - ત્રિપરિમાણીય આકારોનું દ્વિપરિમાણીય રેખાચિત્ર દોરે છે.
 - લંબચોરસ, ચોરસ, ત્રિકોણ, વર્તુળ જેવા દ્વિપરિમાણીય આકારોને તેમના નામથી ઓળખે છે.
- (૩) ● સીધી અને વક્ર રેખા વચ્ચેનો ભેદ પારખે છે.
 - ઊભી, આડી અને ત્રાંસી એમ વિવિધ સ્થિતિમાં સીધી રેખા દોરે છે.
- (૪) ● સળિયો, પેન્સિલ જેવા અપ્રમાણિત વસ્તુના ઉપયોગ દ્વારા આપેલા અંતર / લંબાઈનો અંદાજ કહે છે અને માપે છે.
 - ચમચી, કપ, ડોલ, જેવા અપ્રમાણિત પાત્રો દ્વારા આપેલા પાત્રની કદ/ગુંજાશનો અંદાજ કહે છે અને માપે છે.
 - સાદા ત્રાજવાના ઉપયોગથી ભારે અને હલકા પદાર્થની તુલના કરે છે.
 - અઠવાડિયાના દિવસો અને વર્ષના મહિના ઓળખે છે.
 - દિવસ/કલાકના સમયગાળામાં બનેલ ઘટના/બનાવોને ક્રમ પ્રમાણે ગોઠવે છે.
 - આપેલ માહિતી પરથી અનુમાન કરે છે.
 - સો રૂપિયા સુધીના સિક્કા અને ચલણી નોટોને ઓળખે છે અને તેને લગતાં સરવાળા અને બાદબાકીની પ્રક્રિયા કરે છે.

પ્રજ્ઞા

ધોરણ ૨
ગણિત

વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર



ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ
સર્વ શિક્ષા અભિયાન,
સેક્ટર-૧૭, ગાંધીનગર.
ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૭૯૬૫



સર્વ શિક્ષા અભિયાન
સૌ ભણે, સૌ આગળ વધે